



SUNGOLD
CAPITAL LIMITED

CIN: L65910GJ1993PLCO18956

02nd June, 2021

To
The General Manager,
Corporate Relation Department
Bombay Stock Exchange Limited
Phiroze Jejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai - 400001

SCRIP CODE: 531433

Sub: Copy of Advertisement published in Newspaper - Intimation of Board Meeting of the Company for quarter and financial year ended on 31st March, 2021.

Dear Sir/Madam,

Pursuant to the provision of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, enclosed clippings of advertisement published in 'Lokmitra' Gujarati Edition and 'Free Press Gujarat' English Edition on 1st June, 2021 for intimation of Board Meeting to be held on 10.06.2021 for Audited Financial Results of the Company for the Quarter and year ended on 31st March, 2021.

The copies are attached for your information and records.

Thanking You,

Yours Faithfully,

For Sungold Capital Limited

Chaturani

Versha Chaturani

Company Secretary & Compliance Officer

Membership No: A59225



Registered Office : House no. 7/13 opp White Tower, Station Road, Nandod, Rajpipla Narmada - 393145

Corporate Office : B/ 618, 6th Floor, Jaswanti Allied Business Centre, off: Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064

Email : sungold2006@gmail.com / info@sungoldcapitallimited.com **Website :** www.sungoldcapitallimited.com

Contact Details : 8108756812 / 022-28891692

Cycling enhances the overall fitness level of a person



Vinod Chandrashekhar Dixit
Free-lance Journalist, Writer & Cartoonist
(dixitpatrakar@yahoo.in)

Ahmedabad, 3rd June celebrated as the World Bicycle Day. It is designated as an official United Nations day to spread consciousness about the benefits of cycling. Bicycles are traditionally thought of as the transport of choice for students and people who cannot afford a car. However, bicycles are fast becoming "the new gold" for the wealthy. Unfortunately, many people think bicycles are for kids and often overlook the positive physical and psychological health benefits of cycling.

For a long time now, the bicycle has been recognised as a sustainable mode of transport that is simple, cheap, reliable, and enhances urban mobility and access. Cycling is a healthy, low-impact exercise that can be enjoyed by people of all ages, from young children to older adults. It is also a cheap and good way to boost your metabolism level, thereby fastening your weight loss program. It minimizes the risk of coronary heart disease. Essentially an aerobic exercise, it gives your heart, blood vessels and lungs a workout, thereby reducing the risk of heart problems. It raises your heart rate and gets the blood pumping round your body, and it burns calories, limiting the chance of your being overweight. Cycling enhances the overall fitness level of a person. It makes you breathe deeper and perspire more, thereby leading to a feeling of enhanced body temperature. Doctor also advises that a few miles of cycling per day assure toning and tone muscles. This is because our upper thigh muscles, backside and calf muscles all get to workout.

In most of the cities, many people have started using vehicles to get to their work or to the shops everyday is enough to keep you happy and healthy. Don't we think everyone should embrace cycling to achieve the required level of physical exercise? (B-15 Jyoti-Kalash Society, Jodhpur Road, Sakinaka, Satellite, Ahmedabad - 380 015)

one of the first bicycle called the running machine. This machine allowed people to move around with a faster speed and an increased range. Bicycles are traditionally thought of as the transport of choice for students and people who cannot afford a car. However, bicycles are fast becoming "the new gold" for the wealthy. Unfortunately, many people think bicycles are for kids and often overlook the positive physical and psychological health benefits of cycling.

For a long time now, the bicycle has been recognised as a sustainable mode of transport that is simple, cheap, reliable, and enhances urban mobility and access. Cycling is a healthy, low-impact exercise that can be enjoyed by people of all ages, from young children to older adults. It is also a cheap and good way to boost your metabolism level, thereby fastening your weight loss program. It minimizes the risk of coronary heart disease. Essentially an aerobic exercise, it gives your heart, blood vessels and lungs a workout, thereby reducing the risk of heart problems. It raises your heart rate and gets the blood pumping round your body, and it burns calories, limiting the chance of your being overweight. Cycling enhances the overall fitness level of a person. It makes you breathe deeper and perspire more, thereby leading to a feeling of enhanced body temperature. Doctor also advises that a few miles of cycling per day assure toning and tone muscles. This is because our upper thigh muscles, backside and calf muscles all get to workout.

In most of the cities, many people have started using vehicles to get to their work or to the shops everyday is enough to keep you happy and healthy. Don't we think everyone should embrace cycling to achieve the required level of physical exercise? (B-15 Jyoti-Kalash Society, Jodhpur Road, Sakinaka, Satellite, Ahmedabad - 380 015)

to worry about hours of extra time being added onto your journey if you get stuck in major traffic. Cycling is mainly an aerobic activity, which means that your heart, blood vessels and lungs all get a workout. You will breathe deeper, perspire and experience increased body temperature, which will improve your overall fitness level.

Cycling is a good way to control or reduce weight, as it raises your metabolic rate, builds muscle and burns body fat. If you're trying to lose weight, cycling must be combined with a healthy eating plan. Cycling is a comfortable form of exercise and you can change the time and intensity - it can be built up slowly and varied to suit you. Simply cycling to and from work or to the shops everyday is enough to keep you happy and healthy. Don't we think everyone should embrace cycling to achieve the required level of physical exercise? (B-15 Jyoti-Kalash Society, Jodhpur Road, Sakinaka, Satellite, Ahmedabad - 380 015)

WESTERN RAILWAY WOMEN'S WELFARE ORGANISATION-SOWING GOOD SEEDS WITH NOBLE DEEDS

Ahmedabad, "Welfare" is the main objective of Western Railway Women's Welfare Organisation (WRWWO), and extending humanitarian services to railwaymen and their families is the nucleus of the organization's activities. WRWWO with its dedicated and devoted team, through its several welfare measures has ensured that railwaymen and their families overcome hardships and continue to serve the nation. Smt Tanuja Kansal President of WRWWO has been a guiding force for the organization, as well as its activities.

According to a press release issued by Shri Sumit Thakur-Chief Public Relations Officer of Western Rly, the COVID-19 pandemic which has created havoc globally



Smt Tanuja Kansal - President of WRWWO bringing smiles & hope with organization's magnanimous donations

every year and present them with gift hampers set by bringing some cheer into their lives. Bed sheets, Steel Vacuum Flasks, Immunity Booster bottles were some of the items that have been distributed to the indoor

SmtKansal believes that women employees form the backbone of the organisation. Today women are working in every sphere in the railways. Be it a track woman, station master, ticket checker etc., one finds women working shoulder to shoulder with men. Women employees handle dual responsibility of office as well as home. WRWWO salutes such women and as mark of appreciation awards them especially during Women's Day. In the last two years 78 outstanding women were felicitated during the Women's Day celebration and Rs 1.38 lakh was distributed as cash along with Merit Certificates. Under the aegis of SmtKansal, WRWWO organises various programs all over WR. Seminars, competitions, entertainment programs are organised by Headquarters & Divisional committee members. Keeping with Atmanirbhar Bharat call of Hon'ble Prime Minister, WRWWO promotes Made in

India and encourages dependants of railway employees to take up vocations and become self-reliant. To empower women, sewing machines were donated to the six deserving women dependants of railway employees, which was well appreciated by them. Swachhata Competition was also organised by WRWWO for railway colonies, to motivate the residents to keep their colonies clean. The colonies were ranked based on cleanliness and awarded for their achievement. This inspired the residents in keeping their colonies clean and making it a habit. Thus taking the message of Mahatma Gandhi forward, every day is celebrated as Swachhata Day. SmtKansal is of the opinion that a clean environment is essential for healthy living and she encourages people to do so. Five railway colonies were awarded during the Swachhata drive competition.



WRWWO celebrates International Women's Day by felicitating outstanding women employees. (2nd Prize) Donation of sewing machines to women dependants of railway employees

since 2020 has not deterred WRWWO and its members in continuing with various employee welfare outreach programmes. During National festivals like Republic Day and Independence Day, SmtKansalalong with the committee members visit the indoor patients at WR's Jagjivan Ram Hospital (JRH)

patients. In appreciation to the noble services rendered by the medical fraternity of JRH, two hot & cold-water dispensers, six water purifiers, 15 induction heaters amounting to over a lakh was distributed to JRH. Focus on Women Empowerment, Staff Welfare & Social Awareness

Renault's efforts and commitment towards safer Cars in India



Ahmedabad, Renault India today announced that its ultra-modular and super spacious - Renault TRIBER has been awarded the 4-Star Safety Rating for Adult occupant safety, before we took it to the road. The 4-star adult safety rating by Global NCAP, the foremost global car assessment programme. Launched in August 2019, Renault TRIBER is a Flexible, Attractive & Affordable offering, and has been a game-changing product for Renault in India with more than 75,000 happy customers.

Commenting on this achievement Venkatram Manilapalle, Country CEO & Managing Director, Renault India Operations said, "Safety is of paramount importance for Renault and our products

meet and exceed the requisite safety standards set by India Regulatory Authorities. An outcome of a joint project between Renault teams in India and France, Renault TRIBER has already established itself as a successful product and has seen tremendous acceptance amongst a wide set of car buyers. This is a proud moment for Renault in India, as TRIBER was conceived, developed and produced in India, for Indian customers first, before we took it to the world. The 4-star adult safety rating by Global NCAP for TRIBER reiterates our commitment towards safety." "This latest 4-star adult rating reaffirms that Renault stands by its commitment to make the best in global car safety, accessible to Indian customers. As a customer-focused company, Renault is already future-ready in terms of technology, design and engineering for enhanced safety for our vehicles and Tribes is a testimony to this," he added. (13-9)


vivo debuts new "To Beautiful Moments" campaign for UEFA EURO 2020™



Ahmedabad, As the official smartphone of UEFA EURO 2020™, vivo, the global innovative smartphone brand, wants football fans everywhere to enjoy every beautiful moment during the tournament. With a passion for providing incredible experiences to its users, the brand is channelling its sponsorship platform to help enrich the joys around the game, whether they take place on or off the phone. In its "To Beautiful Moments" campaign debuting today, vivo encourages people to be the beautiful moment, whether that means connecting virtually with friends, family and fellow fans or giving their full attention to the beautiful game, even if it means putting the phone down. "People around the world have been eagerly awaiting this tournament. Now more than ever, we want to celebrate the spirit and sportsmanship of the game

and help fans get the most out of the experience," said Sparky Ni, Senior Vice President and CMO of vivo. "We strive not only to help people capture and share life's magical moments, but to make every moment in life more magical." The new advertising campaign will roll out beginning today, airing on television in Europe, the Middle East, Southeast Asia and China, and around the world on Facebook, Instagram and YouTube. The creative shows fans enjoying, capturing and sharing beautiful moments before and after in-between matches, while sending the message, "give your phone a break, and be there for life's beautiful moments." To learn more about the "To Beautiful Moments" campaign, visit vivo's activations around UEFA EURO 2020™, visit https://www.vivo.com/en/activity/euro2020. (20-4)

DayToDay Health gears up to revolutionise Gujarat's Healthcare



Ahmedabad, DayToDay Health India (DDHI), the Indian arm of MIT-headquartered global leader in acute care space, announced today announced that it is extending its footprint in the state of Gujarat by partnering with the Ahmedabad's KD Hospital, for acute and comprehensive care management. With its remote patient experience and care programs, DDHI aims at enabling masses to experience gold-standard in acute healthcare. Coming in the times of COVID-19, this association would also enable and promote the comprehensive remote handling of the infected patients from the comforts of their homes. As per ICMR (Union Health Ministry) Report on Gujarat Disease Burden (The

India State-Level Disease Burden Report) in the age group of 70 plus over 36 per cent of people suffer from respiratory problems whereas in 40-69 years age group 36.6 per cent have respiratory, 12.5 per cent cardiovascular, and overall NCDs are responsible for the over 40 per cent mortality. The Report finds that in the 15-39 years age group nearly 15 per cent suffer from respiratory ailments and 5.1 per cent with cardio vascular diseases. A Study released on the World Health Day (April 7) finds that NCDs is preventable with early detection and proper management. It is also found that 40 per cent people suffering from critical NCDs are hospitalized and the rest can be taken care at home with the support from caregivers. Acute care management combining state-of-the-art hospital facilities combined with tech-driven initiative, provided by digital health service providers such as DDHI can be a game-changer. (13-9)

Bihar extends curbs as others ease restrictions

New Delhi, Bihar on Monday joined at least 15 states that have extended the lockdown by another week or 10 days with certain relaxations even as other states such as West Bengal and Kerala continued with a complete shutdown till June 15. States including Himachal Pradesh, Delhi, Jammu and Kashmir, Maharashtra and Telangana started the unlocking process from Monday.

SUNGOLD CAPITAL LTD
[CIN: 165910GJ1993PLC018956]
Regd. Off: House No. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpalla, Narmada - 393145.
Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, Off. Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064
Tel. no: 022-28891692, 08108756812
Website: www.sungoldcapitallimited.com
Email: info@sungoldcapitallimited.com

NOTICE
NOTICE is hereby given that pursuant to regulation 47 read with Regulation 29-B & 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company will be held on Thursday, 10th June, 2021 at the Registered office of the Company inter alia, to consider and approve the Audited Financial Results for the quarter and financial year ended on March 31, 2021.
For Sungold Capital Ltd
Sd/-
CS Versha Chaturani
Company Secretary & Compliance Officer
Membership No. A59225
Place: Rajpalla
Date: 01.06.2021

Rajasthan eases lockdown guidelines from tomorrow, conditions apply

Jaipur, Rajasthan chief minister Ashok Gehlot has issued guidelines to start the "unlock" process and eased certain restrictions from Wednesday as cases of the coronavirus disease (Covid-19) have come down in the state. However, exemption for various activities will be given only in areas where the

Pearson VUE's study highlights benefits of IT certification in challenging times

Ahmedabad, As the world starts to slowly recover from the COVID-19 crisis, the information technology industry is well-positioned to help businesses adapt to the "new normal." 2020 saw faster adoption of technology by enterprises and consumers than ever before, with behaviors and processes shifting as the pandemic's impact was felt across all industries. "2020 was undoubtedly a challenging year but the global IT industry proved to be resilient. Our research shows the trust organizations have in technology to address specific business challenges in order to providing opportunities for personal growth," explained Bob Whelan, President of Pearson Assessments. "We are very encouraged by these insights from global IT professionals; people who

positivity rate is less than 10 per cent or the use of oxygen, intensive care unit (ICU) and ventilator beds is less than 60 per cent, Ashok Gehlot has said. "The rate of infection has come down in the state but is not completely eradicated yet. Keeping this in mind, in the new guideline, people of the state are expected to ensure effective

despite difficult circumstances, embraced new certifications with vigor and are set to continue the rapid pace of digital transformation accelerated by the pandemic. Pearson VUE is releasing its latest "Value of IT Certification" report today. The report explores why candidates pursue IT certification and provides detailed insight into the benefits for individuals and employers. The most recent findings are polled from 29,000 candidates who completed IT certification exams between November 2019 and October 2020 - a period of seismic change all around the world. Respondents were from 160 countries and ranged from those who had pursued a certification for the very first time, to seasoned IT professionals who hold multiple IT credentials. (19-10)

Honda India Power Products fulfils Farmers' need



Ahmedabad, Honda India Power Products Limited (HIPP), a leading manufacturer of power products in India, today fulfilled farmers' need of irrigating farmlands efficiently and economically with their NEW offerings in 2-inch and 3-inch categories of "Self-priming" - "Gasoline (petrol) driven water pumps". Farmers looking to irrigate crops have been demanding a lightweight and compact pump to increase their productivity through efficient irrigation requirement of their crops. HIPP has been the market leader in gasoline fuelled water pump category offering a wide range of pump sizes from 2 to 5hp serving the

farmers since the last 35 years. The latest addition of "WB20XD & WB30XD" models fulfils irrigation needs of crops in hilly terrains and plains respectively thus appealing to farmers across different regions & segments in the country.

WB 20XD- the 2 Inch category model - delivers water with the best in class performance at upto 32 meters head and 670 litres discharge volume per minute - while being so light at 24 Kg - fulfilling hilly region farmers' irrigation and ease of carrying needs. WB 30XD - the 3 Inch category model - fulfils economical, timely and efficient irrigation needs of farmers in plains with best in class performance - delivering upto 1,100 litres discharge volume per minute @ 23 meters head making it capable to supply water from canals, borewells, ponds - in short-water bodies of all possible types - thus improving their productivity. (1-7)

Toyota Kirloskar Motor clocks wholesales of 707 units in the month of May 2021

Ahmedabad, Toyota Kirloskar Motor today announced that the company sold a total of 707 units in the month of May 2021, amidst the prevailing restrictions & sporadic lockdowns in several parts of the country. Even before the state-wide lockdown was declared in Karnataka, TKM had already announced its annual plant in Bidadi, starting on the 26th of April until the 14th of May, so as to enhance its operational efficiencies. This further added to the number of non-production days at its plant in Bidadi. For reference, TKM had reported wholesales of 1639 units in the month of May 2020 and 9622 units in the month of April 2021. The cumulative wholesales of TKM in the first five months of 2021, stands at 50,531 units when compared to 24,820 units sold in the corresponding period last year, thereby registering a growth of 104%. Commenting on the

situation, Mr. Naveen Soni, Sr. Vice President, TKM said, "Last month witnessed no production at our plants in Bidadi as well as minimal sales owing to the much needed restrictions & sporadic lockdowns in different parts of the country. Hence comparing last month's performance to that of May 2020 would be highly skewed, as May 2020 had witnessed a gradual start of both operations and sales. More so for TKM, as even before the restrictions were announced in Karnataka, we were well within our planned annual maintenance shutdown, thereby adding onto the number of non-production days. Having said that, the overall market situation as well as consumer sentiments are better than May 2020. In fact, we have even registered a 104% growth in cumulative wholesales clocked from January to May in 2021, when compared to the same period last year. (20-4)

